

વિશ્વ ચકલી દિવસની ઉજવણી ૨૦૧૯

આણંદ કૃષિ યુનિવર્સિટીના પક્ષીશાસ્ત્ર વિભાગ, આણંદ નગર પ્રાથમિક શાળા નં. ૩, ખેતીવાડી અને પે.સેન્ટર શાળા હાડગુડના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૯/૦૩/૨૦૧૯ ના રોજ આણંદ નગર પ્રાથમિક શાળા નં. ૩, ખેતીવાડી અને પે.સેન્ટર શાળા હાડગુડ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવેલ. જે અંતર્ગત પક્ષી વિભાગના સહ- સંશોધન વૈજ્ઞાનિક ડૉ. સી. કે. બોરડનાં માર્ગદર્શન હેઠળ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. જે. જી. દુલેરા દ્વારા શાળાનાં બાળકોને ચકલીઓના જીવન ચક્ર વિશે તથા તેની વર્તણુક અને સતત ઘટતી જતી ચકલીઓની વસ્તી પાછળનાં કારણો અને તેના સંરક્ષણ માટેનાં ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. આ ઉપરાંત પુંઠામાંથી તૈયાર કરેલ માળા તેમજ માટીનાં માળા, બર્ડ ફિડર વિશે તથા ઘરે પડેલાં નકામાં પુંઠાનાં ખોખા માંથી કઈ રીતે આપણે ચકલી માટે માળા તૈયાર કરી શકીએ અને નકામી પાણીની પ્લાસ્ટીકની બોટલ માંથી કઈ રીતે બર્ડ ફિડર તૈયાર કરી શકાય તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. જે. જી. દુલેરા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તથા શ્રીમતી બીનલ મેકવાન, મદદનીશ શિક્ષક દ્વારા કરવામાં આવેલ. પક્ષી વિભાગના શ્રી. રવિ ડાભી, શ્રી. રમેશ ચાવડા તથા શ્રી. કમલ વસાવાએ આ કાર્યક્રમમાં ઉત્સાહભરે વિવિધ પ્રવૃત્તિઓમાં મદદ કરી કાર્યક્રમ ને સફળ બનાવવા મદદ કરેલ.

કાર્યક્રમ ની ઝાંખી

	
<p>આણંદ નગર પ્રાથમિક શાળા નં. ૩, ખેતીવાડીના વિદ્યાર્થીઓને પુંઠાના માળા નું વિતરણ</p>	<p>ડૉ. જે. જી. દુલેરા દ્વારા વિશ્વ ચકલી દિવસ પર વિસ્તૃત વ્યાખ્યાન</p>
	
<p>વિશ્વ ચકલી દિવસની ઉજવણીમાં ભાગ લેનાર આણંદ નગર પ્રાથમિક શાળા નં. ૩, ખેતીવાડીના વિદ્યાર્થી ગણ</p>	<p>ડૉ. જે. જી. દુલેરા દ્વારા આણંદ નગર પ્રાથમિક શાળા નં. ૩, ખેતીવાડીના શિક્ષકો ને બર્ડ ફિડર નું વિતરણ</p>



વિશ્વ ચકલી દિવસની ઉજવણીમાં ભાગ લેનાર પે.સેન્ટર શાળા હાડગુડના વિદ્યાર્થી ગણ



પે.સેન્ટર શાળા હાડગુડના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પુંઠાના માળા નું વિતરણ



ડી. જી. જી. દુલેરા દ્વારા પે.સેન્ટર શાળા હાડગુડના આચાર્ય તથા શિક્ષકગણ ને પુંઠાના માળાનું વિતરણ તથા વિશ્વ ચકલી દિવસ પર વિસ્તૃત ચર્ચા



શ્રી. રમેશ ચાવડા દ્વારા પુંઠાના માળાને ગોઠવવાની પદ્ધતિની સમજણ